

## દિબ્રુગઢમાં દીવ્યાંગો માટે દેશની પ્રથમ ITI

- અસમના મુખ્યમંત્રી સર્વાનંદ સોનાવાલે દિબ્રુગઢમાં દીવ્યાંગો માટે દેશની પ્રથમ ITIનો શિલાન્યાસ કર્યો હતો.

@ અસમ વિષે થોડી જાણકારી:

- મુખ્યમંત્રી: સર્વાનંદ સોનાવાલ

- રાજ્યપાલ: જગદીશ મુખી

- પાટનગર: દિસપુર

- હાઈકોર્ટ ક્ષેત્ર: ગુવાહાટી



## ભારતના 10મી વખત સૌથી ધનિક બન્યા મુકેશ અંબાણી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સતત 10મી વખત દેશના સૌથી અમીર વ્યક્તિ તરીકે ઉભરી આવ્યા છે. મુકેશ અંબાણીની સંપત્તિ 38 અબજ ડોલર થઈ ગઈ છે. ગત એક વર્ષ દરમિયાન મુકેશ અંબાણીની સંપત્તિમાં 15.3 અબજ ડોલર એટલે કે 67 ટકાનો વધારો થયો છે. ફોર્બ્સ મેગેઝિને ગુરુવારે ભારતના અમીરોની યાદી 2017 બહાર પાડી છે. આ યાદી અનુસાર, દેશના ટોપ 100 અમીરોનું નેટવર્થ 26 ટકાના દરથી વધ્યું છે.

**અજીમ પ્રેમજી બીજા નંબર પર**

મુકેશ અંબાણી બાદ બીજા નંબર પર વિપ્રોના અજીમ પ્રેમજી છે. તેમની નેટવર્થ 19 અબજ ડોલર છે. તેમણે ગયા વર્ષની સરખામણીમાં બે કદમ ઉપર છલાંગ મારી છે. તો બીજાબાજુ સન ફાર્માના દિલીપ સંઘવની સંપત્તિ ઘટી છે અને તેઓ બીજા નંબરથી નવમા નંબર પર પહોંચી ગયા છે. તેમની કુલ નેટવર્થ 12.1 અબજ ડોલર છે.

1 Practice is a Best Way For Success | [www.gkgrips.com](http://www.gkgrips.com)

Download Our **Gkgrips** Android Application



\* **ટોપ 20માં બાલકૃષ્ણ:** બાબા રામદેવના સહયોગી અને પતંજલિ આયુર્વેદના આચાર્ય બાલકૃષ્ણ અમીરોની યાદીમાં ઉંચી છલાંગ લગાવી છે. ગત વર્ષે 48માં નંબરથી સીધા 19માં નંબરે પહોંચી ગયા છે. ફોર્બ્સે તેમની કુલ સંપત્તિ 6.55 અબજ ડોલર બતાવી છે.

\* **ટોપ 100 અમીરોમાં સાત ભારતીય મહિલાઓ:** યાદીમાં ઓપી જિંદાલ સમૂહના ચેરમેન સાવિત્રી જિંદાલ અને બાયોટેકનોલોજી ક્ષેત્રના કિરણ મજૂમદાર-શો સામેલ છે. સાવિત્રી જિંદાલ અને પરિવારને યાદીમાં 7.5 અબજ ડોલરની સાથે 16મા સ્થાન પર રાખવામાં આવ્યા છે. ત્યાર બાદ લ્યૂપિનના ગુપ્તા પરિવાર 3.45 અબજ ડોલરની સાથે 40મા સ્થાન પર છે. લ્યૂપિનની બિન-કાર્યકારી પ્રમુખ મંજુ દેશ બંધુ ગુપ્તા છે. હેવેલ્સ ઇન્ડિયાના વિનોદ ગુપ્તા અને પરિવાર 3.11 અબજ ડોલરની સાથે 48મા સ્થાન પર છે. બેનેટ, કોલમેન એન્ડ કંપનીને સંચાલિત કરનાર ઇન્દુ જૈન ત્રણ અબજ ડોલરની સાથે 51મા સ્થાન પર તથા અમલગમેશન પરિવાર 2.5 અબજ ડોલરની સાથે 63મા સ્થાન પર છે. યૂએસવી ઇન્ડિયાના લીના તિવારી 2.19 અબજ ડોલરની સાથે 71મા સ્થાન પર રહ્યાં છે. ઉપરાંત બાયોકોનની મજૂમદાર-શો ને યાદીમાં 2.16 અબજ ડોલરની સાથે 72મા સ્થાન પર રાખવામાં આવ્યા છે.

\* **Paytm ના માલિક સૌથી નાની ઉંમરના અબજપતિ:** યાદીમાં સૌથી નાની ઉંમરના અબજપતિ 39 વર્ષના પેટીએમના માલિક વિજય શેખર શર્મા છે. તેમની કુલ સંપત્તિ 1.47 અબજ ડોલર છે. સૌથી વધુ ઉંમરના અબજપતિ સંપ્રદા સિંહ છે. અલ્કમ લેબોરેટરીઝના માલિક સિંહની ઉંમર 91 વર્ષ છે, તેમની કુલ સંપત્તિ 3.3 અબજ ડોલર આંકવામાં આવી છે.

## કાજુઓ ઇશિગુરોને વર્ષ ૨૦૧૭નું સાહિત્યનું નોબેલ પ્રાઈઝ

- બ્રિટનના લેખક કાજુઓ ઇશિગુરોને વર્ષ 2017નું

લિટરેચર નોબેલ પ્રાઈઝ આપવામાં આવ્યું છે.



2

Practice is a Best Way For Success | [www.gkgrips.com](http://www.gkgrips.com)

Download Our **Gkgrips** Android Application



- તેમને તેની પ્રખ્યાત નવલકથાઓ The Buried Giant, Never Let Me Go, and The Remains of the Day માટે વિશ્વનો સૌથી મોટો એવોર્ડ નોબેલ પ્રાઈઝ આપવામાં આવશે.

## @ નોબેલ પ્રાઈઝ વિષે:

- વિશ્વનો આ સૌથી પ્રતિષ્ઠિત ગણાતો પુરસ્કાર શાંતિ, સાહિત્ય, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન(ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન) માટે આપવામાં આવે છે.

- નોબેલ પુરસ્કાર સ્વીડીશ વૈજ્ઞાનિક અને ડાયનામાઈટના

શોધક આલ્ફ્રેડ નોબેલનું યાદમાં આપવામાં આવે છે.

- વર્ષ 1901 થી નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે અને દર વર્ષે 10 ડીસેમ્બરના રોજ આલ્ફ્રેડ નોબેલની પુણ્યતિથિ નિમિત્તે એવોર્ડ વિતરણ કરવામાં આવે છે.

- વર્ષ 1940 થી 1942 સુધી બીજા વિશ્વયુદ્ધના કારણે નોબેલ પ્રાઈઝ આપવામાં આવ્યો ન હતો.

- અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર આપવાની શરૂઆત 1969માં થઈ હતી.

- ભારતમાં સૌપ્રથમ નોબેલ પ્રાઈઝ મેળવનાર રવીન્દ્રનાથ ટાગોર હતા જેને વર્ષ 1913ના રોજ ગીતાંજલિ માટે આપવામાં આવ્યો હતો.

- વિજ્ઞાનનો સૌપ્રથમ નોબેલ પ્રાઈઝ મેળવનાર ભારતીય વૈજ્ઞાનિક ડો.સી.વી.રામન હતા જેને 1930ના રોજ રામન ઈફેક્ટની શોધ બદલ આપવામાં આવ્યો હતો.



**Gkgrips ટેલીગ્રામ ચેનલમાં જોડવા અહી ક્લિક કરો...**

**Gkgrips એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો....**

3 Practice is a Best Way For Success | [www.gkgrips.com](http://www.gkgrips.com)

Download Our **Gkgrips** Android Application

